

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં ચોથા કન્ફર્મ્ડ (પાક્કા) COVID-19 કેસ પર સીટી ઓફ બ્રેમ્પટનનું નિવેદન

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 12, 2020) – તા. એપ્રિલ 11 નાં રોજ, સીટી ઓફ બ્રેમ્પટનને માહિતગાર કરવામાં આવ્યું હતું કે તેની સેન્ડલવૂડ ફેસિલિટીના ટ્રાન્ઝિટ ઓપરેટરનું COVID-19 પરીક્ષણ હકારાત્મક (પોઝિટિવ) આવ્યું હતું. આ બ્રેમ્પટન ટ્રાન્ઝિટનો ચોથો કન્ફર્મ્ડ કેસ છે.

આ સમયે, સીટીની અગ્રતા આ વ્યક્તિ અને તેઓના કુટુંબીજનોને સહાયતા પૂરી પાડવાની, અને અમારા કર્મચારીઓ, ગ્રાહકો અને આપણાં સમુદાયનું આરોગ્ય અને સુરક્ષાને સંરક્ષણ પૂરું પાડવાની મદદ ચાલુ રાખવાની છે.

સીટીને જાણ થઈ એટલે તરત જ, કર્મચારીઓએ તરત પીલ પબ્લિક હેલ્થને પ્રવૃત્તમય થવા જણાવ્યું.

અસર પામેલી વ્યક્તિએ છેલ્લે એપ્રિલ 7 નાં રોજ નીચેના રૂટ પર કામ કર્યું હતું:

- રૂટ 23 સેન્ડલવૂડ

ઉપર જણાવેલા દિવસે સમીક્ષા કરવામાં આવેલી બસમાં પ્રવાસ કર્યો હોય તેવા લોકો જેઓને સારું લાગતું હોય, કોઈ લક્ષણો ના જણાતા હોય, તેઓએ પોતાની રોજીંદી દિનચર્યા ચાલુ રાખવી જોઈએ અને પબ્લિક હેલ્થને ફોન કોલ ના કરવો જોઈએ. જો તમને લક્ષણો વિકસે તો, કૃપા કરી પબ્લિક હેલ્થને કોલ કરો. જો તમને ઈમરજન્સી મેડિકલ સહાયતા જોઈતી હોય તો, કૃપા કરી 911 નંબર પર કોલ કરો.

પીલ પબ્લિક હેલ્થ એ પણ દર્શાવે છે કે સામાન્ય સમુદાયને હોય તેના કરતા કોઈ વધારાનું જોખમ પબ્લિક ટ્રાન્ઝિટ બસ પ્રવાસીઓને રહેતું નથી.

સીટી સમુદાયને ખાતરી કરાવે છે કે તે COVID-19 નાં ફેલાવા સામે કર્મચારીઓ, ગ્રાહકો અને સમુદાયને સંરક્ષણ આપવામાં મદદ મેળવવા દરેક જરૂરી પગલું લેવાનું ચાલુ રાખશે. વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. આ સમયે, સેનિટાઈઝેશન કામગીરી દર 24 કલાકે થાય છે. સગવડો અને ટર્મિનલ લંચરૂમ્સ, ટેબલ્સ, કાઉન્ટર્સ અને ડોર હેન્ડલ્સને દિવસમાં બે વખત સાફ અને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યાં છે.

ઓપરેટરો અને ઉતારુઓ માટે શારીરિક અંતર જાળવવાને સહાયરૂપ થવા, નીચેના પગલાઓ અમલમાં છે:

- બસ પર ઉતારુઓની ભાર ક્ષમતા અડધી બેઠકો સુધી સીમિત કરેલ છે.
- રીયર ડોર્સ (પાછળના ભાગના દરવાજાઓ) મારફતે પ્રવેશ અને ફ્રી ફેસ (ભાડા ચૂકવણી વગર પ્રવાસ) અમલમાં છે. વધુમાં, મોબિલિટી ડિવાઈસીસ (ચલાયમાનતા સાધનો) ધરાવતા લોકો માટે ફ્રન્ટ ડોર્સ (આગળના દરવાજાથી) પ્રવેશ ચાલુ રાખ્યો છે ત્યારે, ઓપરેટરો અને ઉતારુઓ વચ્ચે જગ્યા પૂરી પાડવા પ્લાસ્ટિકની ચેઈન જેવો અવરોધ મૂકવામાં આવ્યો છે.
- બહુ વ્યસ્ત રૂટ્સ પર, ઉતારુઓ બસમાં હોય તે વખતે શારીરિક અંતર જાળવવા ઉતારુઓની ક્ષમતામાં સહાયરૂપ થવા આર્ટિક્યુલેટેડ બસો મૂકવામાં આવી છે.
- બેઠકોને સાર્થન બોર્ડથી ઓળખવામાં આવે છે અને ઉતારુઓને આ બેઠકો પર ન બેસવાનું કહેવામાં આવ્યું છે.
- વ્યસ્ત કામકાજના કલાકો દરમિયાન અને અઠવાડિક રજાઓમાં ઓછાં વપરાશના રૂટ્સ પર સર્વિસ રદ કરવામાં આવી છે અને શારીરિક અંતર જાળવવામાં અને ભીડ પર કાબૂ રાખવામાં સહાયતા મેળવવા સંસાધનો નવી દિશામાં સૌથી વ્યસ્ત રૂટ્સ પર વાળવામાં આવ્યા છે.

સીટીએ પીલ પબ્લિક હેલ્થ સાથે ઘનિષ્ઠપણે કામ કરવાનું ચાલુ રાખ્યું છે.

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca